

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન ખાતે દ્વિતિય સ્પોર્ટ્સ ડેના યજમાન સીટી બનશે

શનિવારે, એપ્રિલ 6ના રોજ એક રમતગમત મફતમાં અજમાવી જુઓ.

બ્રેમ્પટન, ON (02 એપ્રિલ 2019)– 06 એપ્રિલ 2019 રોજ સીટીના દ્વિતિય એવા બ્રેમ્પટન ખાતેના વાર્ષિક રમતગમત દિન એટલેકે સ્પોર્ટ્સ ડેમાં નાગરિકોને આપણા સમાજમાં રમતગમત વિશે જાણકારી મેળવવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

આ ઈવેન્ટ એવા કોઈ પણ વ્યક્તિ માટે છે જેઓએ સક્રિય બનવું હોય, બ્રેમ્પટન ખાતેના રમતગમતનાં નાના જૂથોમાં જોડાવું હોય અથવા નવા સ્પોર્ટ્સ અને પ્રવૃત્તિઓ અજમાવવી હોય.

નિ:શુલ્ક ડ્રોપ-ઇન સ્પોર્ટ્સમાં સામેલ છે જિમ્નેસ્ટિક્સ, સોફ્ટબોલ, બેઝબોલ, લેક્સ, કબડ્ડી, ક્રિકેટ, સોકર, ટ્રેક, વ્હીલચેર બાસ્કેટબોલ, હોકી, તરણ અને બીજું ઘણું બધું. બ્રેમ્પટન સોકર સેન્ટર અને કેસિ કેમ્પબેલ કમ્યુનિટી સેન્ટર પર તે સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી હાથ ધરાશે.

કાર્યક્રમોનું સમયપત્રક સીટી. તેના સંબંધિત યુથ સ્પોર્ટ્સ ઓર્ગનાઇઝેશનો, અને બ્રેમ્પટન સ્પોર્ટ અલાયન્સ તેમજ અન્ય કમ્યુનિટી સ્પોર્ટ પ્રોવાઇડર્સ પૂરા પાડે છે. અમારા નાના રમતગમતનાં જૂથો સાથે સંપર્ક સાધવા અને તેમના કાર્યક્રમો વિશે વધુ જાણકારી મેળવવા તેમજ બ્રેમ્પટન ફરતે ઉપલબ્ધ બહોળા વૈવિધ્ય ધરાવતી પ્રવૃત્તિઓ માટે પરિવારોને આમંત્રિત કરવામાં આવે છે.

ઈવેન્ટમાં હાજર રહેનારાઓને ત્રણ સ્ટેમ્પ્સ ભેગી કરવાથી એક ડ્રોમાં પ્રવેશ મેળવીને ઈનામ જીતવાની તક સાંપડશે – એક સ્ટેમ્પ દરેક સ્પોર્ટ્સ માટે જે તેઓ તે દિવસે અજમાવશે.

આખા ઈવેન્ટના સમયપત્રક માટે અહિં મુલાકાત લો www.brampton.ca/recreation.

રસપ્રદ હકિકતો

- બ્રેમ્પટનમાં 268 કરતા વધુ ઈન્ડોર અને આઉટડોર રમતગમતના ફિલ્ડ છે, 30 આનંદપ્રમોદની સવલતો, 15 આઈસ પેડ, 13 તરણ કુંડ, સાત ફિટનેસ સેન્ટરો, ચાર આઉટડોર સ્કેટિંગ રિંક્સ, એક 9-હોલ સાર્વજનિક ગોલ્ફ કોર્સ અને 1 સ્કિ હિલ છે
- સીટીના ત્રણ ટોચના રજિસ્ટ્રેશનો થાય છે: સ્વિમિંગ, કેમ્પ્સ અને સ્પોર્ટ્સમાં
- બ્રેમ્પટનમાં 20,000 સહભાગીઓ સાથેના 20 યુથ સ્પોર્ટ્સ સંબંધિત જૂથો છે , અને 80 પુખ્ત કમ્યુનિટી જૂથો છે

ક્વોટ

"બ્રેમ્પટન પાસે રમતગમતને પ્રોત્સાહિત કરવાનો સમૃદ્ધ ઇતિહાસ છે, જેને કારણે ઉત્કૃષ્ટ રમતવીરો અને રમતગમતના સમર્પિત ચાહકો ઊભા થયા છે. આનંદ માટે, મિત્રો બનાવવા અને સક્રિય નિરોગી જીવન શૈલી જાળવવા માટે રમતો રમવી સારામાં સારી રીત છે. બ્રેમ્પટન ખાતેનો સ્પોર્ટ્સ દિન વિવિધ વિકલ્પો તપાસવા અને પોતે માણી શકે એવી રમત શોધવાની જોરદાર તક આપે છે."

- मेयर पैट्रिक ब्राउन (Mayor Patrick Brown)

-30-

सीटी ओफ़ ब्रॅम्पटन विशे विषे वधु माडिती माटे अडीं मुलाकात वो www.brampton.ca अमने झेवो करो [Twitter](https://twitter.com) पर, [Facebook](https://facebook.com) पर, अने [Instagram](https://instagram.com) पर.

मिडिया संपर्क:

मोनिका दुग्गल

कोऑर्डिनेटर, मिडिया अन्ड कम्युनिटी एंगेजमेन्ट

व्यूडान्मक संवाद

सीटी ओफ़ ब्रॅम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca